

ગુજરાત જાહેર સેવા આયોગ

અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની બીજી યાદી

વંચાણે લીધી: આયોગની તા.૩૦.૦૮.૨૦૧૬ની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી

૧. સરકારી ઇજનેરી કોલેજ ખાતે રસાયણશાસ્ત્રના સહપ્રાધ્યાપક, ગુજરાત શિક્ષણ સેવા, વર્ગ-૨ (કોલેજ શાખા)ની જગ્યાએ ભરતી કરવા માટે જા.ક.૧૩૧/૨૦૧૫-૧૬ના સંદર્ભમાં આયોગ દ્વારા તા.૧૨.૦૬.૨૦૧૫ ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે આયોગે અરજી ચકાસણીની પાત્રતા માટે નક્કી કરેલ લાયકી ધોરણ (જે તે કેટેગરીમાં મેરીટ યાદી મુજબ ઉતરતા ક્રમમાં જરૂરી સંખ્યા અનુસારના છેલ્લા ઉમેદવારના ગુણ) મુજબ અરજી ચકાસણીને પાત્ર કેટેગરી વાઇઝ ઉમેદવારોના કુલ: ૨૨ બેઠક નંબરોની યાદી તા.૩૦.૦૮.૨૦૧૬ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી.

૨. આ ૨૨ ઉમેદવારોના બેઠક નંબરોની પાત્રતા ચકાસણી બાદ આયોગના તા.૧૪.૧૦.૧૯૮૬ના કચેરી હુકમથી નક્કી થયેલ માપદંડ પ્રમાણે નોર્મ્સ મુજબ રૂબરૂ મુલાકાત માટે પાત્ર પુરતા ઉમેદવારો ન મળતાં લાયકી ધોરણ (જે તે કેટેગરી માં ખુટતી સંખ્યા માટે મેરીટ યાદી મુજબ ઉતરતા ક્રમમાં જરૂરી સંખ્યા અનુસારના છેલ્લા ઉમેદવારના ગુણ) નીચું લઈ જઈ વધુ કુલ: ૦૭ બેઠક નંબરોની બીજી યાદી અરજી ચકાસણી માટે નીચે મુજબ જાહેર કરવામાં આવે છે.

(૧) બિન અનામત (કોમન):

101000003	101000045	101000057	101000058	101000089
-----------	-----------	-----------	-----------	-----------

TOTAL: 05

(૨) બિન અનામત (મહિલા):

101000079	101000112	TOTAL: 02
-----------	-----------	-----------

TOTAL: 05 + 02 = 07

૩. અરજી ચકાસણીની પાત્રતા બાદ રૂબરૂ મુલાકાતને પાત્ર થતા ઉમેદવારોની યાદી હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે.

૪. અરજી ચકાસણીને પાત્ર ઠરેલ ઉમેદવારોએ આ જાહેરાતના અનુસંધાને “ઓન-લાઇન” કન્ફર્મ થયેલ અરજી પત્રક સાથે ફી ભર્યાના ચલણની નકલ (જે ઉમેદવારોએ ફી ભરવાની જરૂરી હોય) અને લાગુ પડતા જરૂરી દસ્તાવેજો/ પ્રમાણપત્રોની નકલ નીચેના ક્રમાનુસાર (૧) જન્મ તારીખના પુરાવા માટે એસ.એસ.સી. કેડીટ પ્રમાણપત્રની નકલ (જન્મ તારીખના પુરાવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહીં) (૨) નામ/અટકમાં ફેરફાર કરાવેલ હોય તો સરકારી ગેઝેટની નકલ/ પરિણીત મહિલા ઉમેદવાર માટે લગ્ન નોંધણી પ્રમાણપત્રની નકલ (૩) વિધવા મહિલા ઉમેદવાર ના કિસ્સામાં પુનઃ લગ્ન કર્યા નથી તેવી એફિડેવિટ (૪) શારિરીક રીતે અશક્ત ઉમેદવાર માટે સા.વ.વિભાગના તા.૦૧. ૧૨.૨૦૦૮ના પરિપત્ર થી નિયત થયેલ નમુના મુજબના અશક્તા પ્રમાણપત્રની નકલ (૫) શૈક્ષણિક લાયકાત ના સંદર્ભમાં જાહેરાતમાં દર્શાવેલ વિદ્યાશાખાના સ્નાતક

2

/ અનુસ્નાતક ની પદવી પ્રમાણપત્ર ની નકલ અને સ્નાતક/અનુસ્નાતકની પદવીના અંતિમ વર્ષના ગુણપત્રકની નકલ (૬) વિદેશની યુનિવર્સિટી માંથી પદવી મેળવેલ હોય તો તેની માન્યતા અંગેના પુરાવાની નકલ (૭) શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં જાહેરાતમાં દર્શાવેલ વિદ્યાશાખાના સ્નાતક/અનુસ્નાતકની પદવીની સમકક્ષ લાયકાત ધરાવે છે તેવો હક્ક દાવો હોય તો ઉમેદવારે સમકક્ષતા પ્રસ્થાપિત કરતા આદેશો / અધિકૃતતાની વિગતો / પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. (૮) ગુજરાત સરકારની સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓએ રૂબરૂ મુલાકાત સમયે સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ સા.વ.વિભાગના તા.૦૮.૧૧.૧૯૮૯ ના પરિપત્રથી નિયત થયેલ નમુનામાં “ના વાંધા પ્રમાણપત્ર” (અસલમાં) અચૂક રજુ કરવાનું રહેશે. (૯) સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ અનુભવના પ્રમાણપત્રની નકલ [જેમાં સંસ્થાના લેટરપેડ ઉપર (ક) ધારણ કરેલ જગ્યા / હોદ્દો (ખ) અનુભવનો ક્રમાનુસાર સમયગાળો (ગ) અનુભવનો પ્રકાર અને (ઘ) મેળવવામાં આવતા પગાર અને ભથ્થાઓની વિગત દર્શાવેલ હોય] અને (૧૦) અન્ય લાગુ પડતા હોય તેવા આધાર / પુરાવા અચૂક જોડીને તા.21.03.2017 સુધીમાં આયોગની કચેરીમાં સંયુક્ત સચિવશ્રી (આર-૩) ને મળે તે રીતે મોકલી આપવા જણાવવામાં આવે છે.

સ્થળ: ગાંધીનગર-૩૮૨૦૧૦

તારીખ: ૦૮.૦૩.૨૦૧૭

Sd/-

(ટી. એચ. સોની)

સંયુક્ત સચિવ

ગુજરાત જાહેર સેવા આયોગ